

**B.Com. Semester - 4 (CBCS) Examination
March/April-2023 [NEW COURSE]
English Language - 4 (FND)(Foundation)**

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

Que.1 (A) Change the voice. (Any Five)

(05)

1. We must pay taxes.
2. Dr. Raj is playing a game.
3. Can you win the prize?
4. Namdev won the race.
5. Mayuri writes an article.
6. Shyamali will finish her work today
7. What do you do?

Que.1 (B) Choose the correct word from the brackets. (Any Five)

(05)

1. Ram is greater _____ Shyam. (than/then)
2. We will visit Abu next _____. (week/ weak)
3. The latest _____ of 'You Can Win' has been published. (edition/addition)
4. _____ Hindi, I can speak Tamil fluently. (Except/Accept)
5. _____ makes man perfect. (Practise/ Practice)
6. Sardar Patel is the man of _____. (principals/principles)
7. Porbandar is the _____ place of Gandhiji. (berth/birth)

Que.1 (C) Give the meaning of any five idioms. (Any Five)

(05)

1. A hue and cry
2. All in all
3. Fleet of foot
4. By hook or by crook
5. Child's play
6. In a nutshell
7. Keep it up

Que.1 (D) Provide the punctuation marks to any five sentences of the following.

(05)

1. sachin did not like playing cricket,
2. how things are going on
3. what a great man he was :
4. Rani Laxmibai said to Major Ellis meri Jhansi nahi (ungi
5. how imazing
6. he said to her bring a glass of water
7. action and reaction are equal and opposite

- Que.2 (A) Prepare any one questionnaire of the following. (10)
1. Socio- economic condition of primary teacher
 2. Consumer's responses towards newly introduced tooth paste
- Que.2 (B) Translate the following sentences into Gujarati. (10)
1. Manu was frightened by the snake.
 2. Subhash Chandra was known as Netaji.
 3. Alan liked helping the old man.
 4. Her horoscope predicted that she will be a great queen.
 5. Good leadership involves touching others' feelings.
 6. The teachers should be respected.
 7. If I were a bird!
 8. This mango is too ripe to eat.
 9. Kali earned his livelihood by hauling bags of rice.
 10. The real India resides in rural India.
- Que.3 (A) Answer any six questions in one line each. (06)
1. Who is the author of the story 'Three Questions'?
 2. Who came to help Alan with the old man?
 3. Whose names were to be written in golden colours?
 4. What was the name of the son the king adopted?
 5. What was King's third question to the hermit?
 6. Who wrote 'Laxmibai-The Brave Rani of Jhansi'?
 7. When did Laxmibai born?
 8. Who was known as Netaji?
- Que.3 (B) Write any three short answers. (09)
1. How did Kali's friends console him after the incident?
 2. Explain in detail the title of the story 'Playing the Game'.
 3. How did the king help the hermit?
 4. How did Laxmibai become the queen of Jhansi?
 5. What did Alan do with the old man?
- Que.4 Write any two short notes. (15)
1. King's Three Questions
 2. Character sketch of Rani Laxmibai
 3. A Speech of Subhash Chandra Bose
 4. A Character sketch of Kali

647510

BCM4MeIC101x

Seat No : _____

B.Com. Semester - 4 (CBCS) Examination
March/April-2023 [NEW COURSE]

Macro Economics and International Trade(Core)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ વ્યાપારચક્ર એટલે શું? તેના લક્ષણો સમજાવો. (૨૦)
અથવા
- પ્રશ્ન.૧ કુગાવો એટલે શું? તેના કારણો સમજાવો.
- પ્રશ્ન.૨ આંતરરાષ્ટ્રીય વેપારનો તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત સમજાવો. (૨૦)
અથવા
- પ્રશ્ન.૨ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાના કારણો સમજાવો.
- પ્રશ્ન.૩ લેણદેણની તુલામાં ખાધના કારણો સમજાવો. (૧૫)
અથવા
- પ્રશ્ન.૩ લેણદેણની તુલામાં સમતુલા લાવવાના ઉપાયો સમજાવો.
- પ્રશ્ન.૪ વિદેશી વિનિમયદર નિર્ધારણનો માંગ અને પુરવઠાનો સિદ્ધાંત સમજાવો. (૧૫)
અથવા
- પ્રશ્ન.૪ આંતરરાષ્ટ્ર નાણા ભંડોળની સવિસ્તાર ચર્ચા કરો.

ENGLISH VERSION

- Que.1 What is business cycle? explain its characteristics. (20)
OR
- Que.1 What is inflation? explain its reasons.
- Que.2 Explain the comparative cost theory of international Trade. (20)
OR
- Que.2 Explain the causes of international Trade arisen.
- Que.3 Explain the reasons of deficit in balance of payment. (15)
OR
- Que.3 Explain the remedies of deficit in balance of payment.
- Que.4 Explain the demand and supply theory of exchange rate. (15)
OR
- Que.4 Explain the International Monetary Fund (IMF) in Detail.

B.Com. Semester - 4 (CBCS) Examination
March/April-2023 [NEW COURSE]
Corporate Accounting - 2(Core)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ મહેશ લી. અને ભરત લી. ના તારીખ 31/3/2021 ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ હતા:

(૨૦)

| જવાબદારી | મહેશ લી. | ભરત લી. | મિલકતો | મહેશ લી. | ભરત લી. |
|-------------------------|------------------|-----------------|--------------|------------------|-----------------|
| ભરાયેલી મૂડી: | | | | | |
| ઓર્ડિનરી શેર દરેક રૂ. | | | પાઘડી | 1,00,000 | — |
| 100 નો પુરા ભરાયેલા | 10,00,000 | 5,00,000 | જમીન-મકાન | 3,00,000 | 1,00,000 |
| 6% ના પ્રેફ. શેર રૂ.100 | | | સાચા-ચંત્રો | 6,00,000 | 3,00,000 |
| નો પુરા ભરાયેલા | 5,00,000 | — | રોકાણો | 1,00,000 | 20,000 |
| સામાન્ય અનામત | — | 1,20,000 | સ્ટોક | 2,50,000 | 1,50,000 |
| 10% ના ડિવેન્ચર | 2,00,000 | — | દેવાદારો | 3,00,000 | 2,00,000 |
| બેંક લોન | 1,50,000 | — | રોકડ-બેંક | 1,70,000 | 30,000 |
| કામદાર અકસ્માત વળતર | — | 80,000 | પ્રા.ખર્ચા | 30,000 | — |
| ભંડોળ | | | ન. જુ .ખાતું | 1,50,000 | — |
| લેણદારો | 1,50,000 | 1,00,000 | | | |
| | 20,00,000 | 8,00,000 | | 20,00,000 | 8,00,000 |

ઉપરોક્ત તારીખે બંને કંપનીઓએ સંયોજન કરી રૂપિયા 25,00,000 ની સત્તાવાર મૂડી સાથે સંગઠન લી. નામની નવી કંપની સ્થાપવાનું નક્કી કર્યું. જે રૂ.100 નો ચેક એવા 20,000 ઓર્ડિનરી શેર અને 5000 10% ના પ્રેફરન્સ શેરોમાં વહેંચાયેલી હતી.

મહેશ લી. ના રોકાણો અને ભરત લી. ની રૂ.10,00,000ની રોકડ સિવાયની મિલકતો અને દેવા લેવા. કંપનીઓની કાચમી મિલકતોની બજાર કિંમત ચોપડે કિંમત કરતા 20% વધુ ગણવી. ચુકવણીની શરતો નીચે મુજબ હતી.

1. બંને કંપનીઓના પાંચ ઓર્ડિનરી શેરના બદલામાં સંગઠન લિમિટેડના છ ઓર્ડિનરી શેર પુરા ભરાયેલ ગણી 10% ના પ્રીમિયમ આપવા.
2. મહેશ લિમિટેડના પાંચ પ્રેફરન્સ શેરના બદલામાં સંગઠન લિ.ના ચાર પ્રેફરન્સ શેર પુરા ભરાયેલ તેમજ રૂ. 50,000 રોકડાઆપવા.
3. મહેશ લિમિટેડના ડિવેન્ચર હેલ્ડરોને 8% પ્રીમિયમ મળી રહે તે રીતે સંગઠન લિમિટેડે પોતાના 12% ના ડિવેન્ચર્સ રૂ. 100 નો ચેક એવા 10% ના વટાવે આપવા.
4. મહેશ લિમિટેડને રૂપિયા 14,000 રોકડા આપવા સંગઠન લિમિટેડ પોતાના બાકીના ઓર્ડિનરી શેર દીઠ રૂ. 20 ના પ્રીમિયમ જાહેર જનતામાં બહાર પાડ્યા જે પુરા ભરાઈ ગયા.
5. પ્રાથમિક ખર્ચ રૂ.10,000 થયો.

ઉપરોક્ત માહિતીના આધારે જો સંયોજન "ખરીદી સ્વરૂપ" નું હોઈ તો બંધ થતી બંને કંપનીઓના ચોપડે જરૂરી ગણતરી કરી મહેશ લી.નાં ચોપડે જરૂરી ખાતા બનાવો અને નવી કંપની સંગઠન લિમિટેડનું પાકું સરવૈયું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.૧ જો ઉપરોક્ત મહેશ લી. અને ભરત લી.નું સંયોજનનું સ્વરૂપ "વિલીનીકરણ સ્વરૂપ" નું હોઈ તો બંને કંપનીના ચોપડે જરૂરી ગણતરી કરી આમનોંધ લખો અને સંગઠન લિ. નું સમાવેશ બાદનું પાકું સરવૈયું બનાવો.

પ્રશ્ન.૨ ધારા લીમિટેડ અને હેત્વી લિમિટેડના તારીખ 31-3-2021ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે:

| જવાબદારી | ધારા લિ. રૂ. | હેત્વીલિ. રૂ. | મિલકતો | ધારાલિ. રૂ. | હેત્વીલિ. રૂ. |
|--|--------------|---------------|-------------|-------------|---------------|
| ભરપાઈ શેરમૂડી દરેક રૂપિયા 50 નો પુરા ભરપાઈ | 3,00,000 | 1,80,000 | પાપડી મકાનો | 50,000 | 30,000 |
| શેર પ્રીમિયમ | 50,000 | 40,000 | યંત્રો | 1,50,000 | 90,000 |
| મૂડી અનામત | 1,00,000 | 20,000 | રોકાણો | 3,00,000 | 80,000 |
| ન.નુ. ખાતું | 40,000 | 10,000 | ફર્નિચર | 50,000 | 40,000 |
| 8% ના ડિબેન્ચર | 1,00,000 | 80,000 | સ્ટોક | --- | 50,000 |
| લેણદારો | 50,000 | 40,000 | બેંકસિલક | 50,000 | 30,000 |
| દેવીહૂંડીઓ | 15,000 | 20,000 | લેણીહૂંડીઓ | 30,000 | 25,000 |
| ચૂકવવાનો બાકી પગાર | 25,000 | --- | દેવાદારો | 25,000 | 15,000 |
| | 6,80,000 | 3,90,000 | | 6,80,000 | 3,90,000 |

ધારા લિ.માં હેત્વી લિ.નો સમાવેશ તારીખ 01/04/2021 થી નીચેની શરતોએ કરવામાં આવ્યો:

- હેત્વી લિમિટેડની બેંક સિલક સિવાયની બધી મિલકતો અને દેવા લઈ લેવા.
- હેત્વી લિમિટેડની મિલકતો અને દેવાની કિંમત નીચે મુજબ આંકેલ છે :
મકાનો રૂ.810000, યંત્રો રૂ.880000, રોકાણો રૂ.350000, ફર્નિચર રૂ.600000, સ્ટોક રૂ.250000,
લેણીહૂંડીઓ રૂ.150000 તેમજ દેવાદારો રૂ.270000, લેણદારો રૂ.430000 અને દેવીહૂંડી રૂ.18,000.
- હેત્વી લિ.ના ડિબેન્ચર 25% પ્રીમિયમ મળે તેટલા ધારા લિ. ના 10% ના ડિબેન્ચરો આપવા.
- હેત્વી લિ.ના ઇન્વિટી શેરહોલ્ડરોને ધારણ કરેલ 5 શેરના બદલામાં ધારા લિ.ના 3 શેર આપવા તથા દરેક ઇન્વિટી શેર દીઠ રૂ. 25 રોકડા આપવા.
- હેત્વી લિ.નો વિસર્જન ખર્ચ રૂ.5,000 થયો. જે ધારા લિમિટેડ ચૂકવવાનો છે.
- ઉપરોક્ત ખરીદ કિંમત ચૂકવવાના હેતુથી ધારા લિમિટેડ 2,000 શેર 10% ના પ્રીમિયમથી જાહેર જનતાને બહાર પાડ્યા અને પૂર્ણ ભરપાઈથયા

ઉપરની વિગતો પરથી તૈયાર કરો:

હેત્વી લિમિટેડના ચોપડે જરૂરી ખાતા બનાવો તથા ધારા લી. ચોપડે સમાવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.૨ આરતી લિ. અને કિન્ના લિ. ના તારીખ 31-3-2021 ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ હતાં:

| જવાબદારી | આરતી લિ. રૂ. | કિન્ના લિ. રૂ. | મિલકતો | આરતી લિ. રૂ. | કિન્ના લિ. રૂ. |
|--|--------------|----------------|---|--------------|----------------|
| ભરાયેલી શેરમૂડી ઇન્વિટી શેર દરેક રૂ. 100 નો પુરા ભરાયેલ ઇન્વિટી શેરો દરેક રૂ. 50 લેખે ભરાયેલ | 8,00,000 | --- | કાયમી મિલકત રોકાણો (બજાર કિંમત રૂ.1,00,000) | 10,80,000 | 6,00,000 |
| સામાન્ય અનામત | 1,00,000 | --- | ચાલુ મિલકતો પ્રા. ખર્ચ | --- | 90,000 |
| 10% ના ડિબેન્ચર્સ | 3,00,000 | 2,00,000 | ન.નુ.ખાતું | 3,60,000 | 2,88,000 |
| લેણદારો | 3,00,000 | 3,00,000 | | 60,000 | 22,000 |
| | 15,00,000 | 11,00,000 | | 15,00,000 | 11,00,000 |

તા.1-4-2021ના રોજથી આરતી લિ. એ ક્રિષ્ના લિ. ને નીચેની શરતોએ સમાવી લેવાનું નક્કી કર્યું:

1. આરતી લિ.ની ચોપડે દર્શાવેલી કાયમી મિલકતો તેની બજાર કિંમત કરતા 10% ઓછી છે, જ્યારે ક્રિષ્ના લિ.મિટેડની ચાલુ મિલકતોમાં રૂ. 88,000 નો સ્ટોક છે, જે 10% વધુ કિંમતે આંકવામાં આવેલ છે.
2. ખરીદકિંમત પેટે ક્રિષ્ના લિ.ના 10 ઇક્વિટી શેરના બદલામાં આરતી લિ.ના 3 ઇક્વિટી શેરો પુરા ભરાયેલા ગણી બંને કંપનીના શેરોની આંતરિક કિંમત ધ્યાનમાં લઈને આપવા અને જરૂરી રકમ રોકડમાં ચૂકવવી.

પ્રશ્ન.3 ક્રિષ્ના લિ. ના ચોપડે જરૂરી માતાઓ તૈયાર કરો અને આરતી લિ. ના ચોપડે સમાવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. શ્રુતિ લિ.મિટેડનું તારીખ 31/03/2021ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે:

(૧૫)

| જવાબદારી | Rs. | મિલકતો | Rs. |
|---|----------|---------------|----------|
| બહાર પાડેલ ધ્યાપણ : | | | |
| 500 6% ના ક્યુ. પ્રેક. શેર દરેક રૂ. 100 નો એક એવા | 50,000 | પાઘડી | 55,000 |
| 15000 ઇક્વિટી શેર દરેક રૂ. 10 નો પૂરેપૂરા ભરાયેલ | 1,50,000 | પરચુરણ મિલકતો | 1,64,500 |
| 7% ના ડિબેન્ચર્સ | 30,000 | રોકડ | 500 |
| પરચુરણ લેણદારો | 20,000 | ન. નુ. ખાતું | 30,000 |
| | 2,50,000 | | 2,50,000 |

પ્રેક્ટરન્સ શેરનું ચાર વર્ષનું ડિવિડન્ડ બાકી છે. પુનઃચલના અંગેની નીચેની યોજના સ્વીકારી છે:

1. રાહોડ લિ. નામની નવી કંપનીની સ્થાપના રૂપિયા 10 નો એક એવા ઇક્વિટી શેરની રૂપિયા 3,25,000 ની સત્તાવાર મૂડીથી કરવી.
2. નવી કંપનીનો એક ઇક્વિટી શેર રૂ. 5 ભરપાઈ જૂની કંપનીના એક શેરના બદલામાં આપવો.
3. 20 ઇક્વિટી શેર રૂ.5 ભરપાઈ નવી કંપનીના જૂની કંપનીના દરેક પ્રેક્ટરન્સ શેર દીઠ આપવો.
4. પ્રેક્ટરન્સ શેર પર બાકી ડિવિડન્ડ જતું કરવું.
5. ડિબેન્ચર હોલ્ડરોને નવી કંપનીના 2000 પુરા ભરપાઈ ઇક્વિટી શેર મળશે.
6. પરચુરણ લેણદારો નવી કંપનીએ લઈ લેવા.
7. બાકીના બહાર ન પાડેલા શેર ડાયરેક્ટરોએ પૂરા ભરપાઈ તરીકે લઈ લેવા.
8. રાહોડ લિ.એ જૂની કંપનીની મિલકતો, પરચુરણ મિલકતો રૂ. 40,000 માંડી વાળીને અને પાઘડીમાં જરૂરી ફેરફારો કરીને લઈ લેવી.

ઉપરોક્ત માહિતીનાં આધારે

(A) શ્રુતિ લિ.ના ચોપડામાં માલ-મિલકત નિકાલ ખાતું તથા શેર હોલ્ડરોનું ખાતું બનાવો.

(B) રાહોડ લિ.ના ચોપડા ખોલવા માટે જરૂરી આમનોંધ લખો અને

(C) રાહોડ લિ.નું યોજનાની અસર પછીનું પાકું સરવૈયું બનાવો

અથવા

પ્રશ્ન.3 કૌશિક લિ. નું તારીખ 31/03/2021 ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે:

| જવાબદારી | Rs. | મિલકતો | Rs. |
|--|----------|----------------|----------|
| 8% ના 10000 ક્યુ. પ્રેક. શેર દરેક રૂ. 10 નો પુરા ભરાયેલા | 1,00,000 | પાઘડી | 1,00,000 |
| રૂ.100 નો એક એવા 2000 ઇક્વિટી શેર | 2,00,000 | મકાન | 90,000 |
| | | યંત્રો | 1,50,000 |
| અનામત ભંડોળ | 50,000 | સ્ટોક | 50,000 |
| ન. નુ. ખાતું | 30,000 | દેવાદારો | 52,000 |
| 6% ના ડિબેન્ચર | 80,000 | - ધા.ખ.અ. | -2,000 |
| લેણદારો | 40,000 | લેણીહૂંડી | 10,000 |
| | | બેંકસિલક | 45,000 |
| | | પ્રાથમિક ખર્ચા | 5,000 |
| | 5,00,000 | | 5,00,000 |

તારીખ ૦૧/૦૪/૨૦૨૧ થી કંપનીનો ધંધો (બેંક સિલક સિવાય) લઈ લેવા પ્રકાશ લિમિટેડની રચના કરવામાં આવી. શરતો નીચે પ્રમાણે છે:

1. જૂની કંપનીના દરેક ૪૪ નાં પ્રેફરન્સ શેરના બદલામાં નવી કંપનીનો રૂ.૧૦૦ નો એક એવો 1 ઇક્વિટી શેર પૂરેપૂરા ભરપાઈ થયેલ આપવો.
2. જૂની કંપનીના 5 ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીના 4 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 ના પૂરેપૂરા ભરપાઈ થયેલ આપવા.
3. જૂની કંપનીના ડિબેન્યર શેલ્ડરોને નવી કંપનીના 7% ના એટલા ડિબેન્યર આપવા કે જેથી તેમને 5% પ્રીમિયમ મળે.
4. વિસર્જન ખર્ચ રૂ.૩,૦૦૦ નવી કંપની ભોગવશે અને ચૂકવશે.
5. લેણીહૂંડીઓ નવી કંપનીએ લેવી નહીં. લેણીહૂંડીના રૂ. 8000 ઉપજ્યા.

ઉપરની વિગત ઉપરથી કૌશિક લિ.ના ચોપડામાં જરૂરી ખાતા તૈયાર કરો અને આમનોંધ લખો અને પ્રકાશ લિ.ના ચોપડામાં જરૂરી નોંધ તથા પાકું સરવૈયું તૈયાર કરો.

પ્રશ્ન.૪ નીલ લી. એ રૂ.૧૦ નો ૧ એવા ૧૦,૦૦,૦૦૦ શેર બહાર પડ્યા
બાંધધરી દલાલોએ તમામ શેર વેચાણની બાંધધરી નીચે મુજબ આપી છે

- દેવ : ૪૦ %
- દાસ : ૩૦ %
- હરી : ૨૦ %
- લાલ : ૧૦ %

કુલ રૂ.૬,૫૦,૦૦૦ શેર માટે અરજીઓ મળી, જે પૈકી નિશાની વાળી અરજીઓ નીચે મુજબ હતી

- દેવ : ૪,૫૦,૦૦૦ શેર
- દાસ : ૧,૬૦,૦૦૦ શેર
- હરી : ૧,૬૦,૦૦૦ શેર
- લાલ : ૧,૦૦,૦૦૦ શેર

બાંધધરી દલાલો પત્ર કમીશન મેળવવા પાત્ર છે. બાંધધરી દલાલોની જવાબદારીની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરો અને નીલ લીમિટેડના ચોપડે જરૂરી આમનોંધ લખો

અથવા

પ્રશ્ન.૪ બાંધધરી કમીશનનો અર્થ આપો અને બાંધધરી કમીશન અંગે કંપની ધારાની જોગવાઈઓ સમજાવો.

ENGLISH VERSION

Q.1 The following were the Balance Sheet of Mahesh Ltd. and Bharat Ltd. as on 31/03/2021:

| Liabilities | Mahesh Ltd. | Bharat Ltd. | Assets | Mahesh Ltd. | Bharat Ltd. |
|---------------------------------|------------------|-----------------|-------------------|------------------|-----------------|
| Paid up Capital: | | | Goodwill | 1,00,000 | --- |
| Equity shares of Rs. 100 each | | | Land-Building | 3,00,000 | 1,00,000 |
| Fully paid up | 10,00,000 | 5,00,000 | Plant-Machinery | 6,00,000 | 3,00,000 |
| 6% Pref. Shares of Rs. 100 each | | | Investments | 1,00,000 | 20,000 |
| Fully paid up | 5,00,000 | --- | Stocks | 2,50,000 | 1,50,000 |
| General Reserve | --- | 1,20,000 | Debtors | 3,00,000 | 2,00,000 |
| Bank loan | 1,50,000 | --- | Cash & Bank | 1,70,000 | 30,000 |
| 10% Debentures | 2,00,000 | --- | Preliminary exps. | 30,000 | --- |
| Workers' Accident Comp. Fund | --- | 80,000 | Profit & Loss A/C | 1,50,000 | --- |
| Creditors | 1,50,000 | 1,00,000 | | | |
| | 20,00,000 | 8,00,000 | | 20,00,000 | 8,00,000 |

On the above date, both the companies decided to amalgamate and form a new company Sangathan Ltd. with an authorized capital of Rs. 25,00,000 divided into 20,000 equity shares and 5,000 10% pref. Share of Rs. 100 each. Assets and liabilities of both the companies are to be taken over except investments of Mahesh Ltd. and cash balance of Rs. 10,000 of Bharat Ltd.

The market value of used assets of both the companies to be taken at 20% more than the book value.

Payment terms are as follows:

1. The equity of both the companies will be given 6 fully paid equity. Shares of Sangathan Ltd. for every 5 equity held by them at a premium of 10%.
2. The preference shareholders of Mahesh Ltd. will be given 4 fully paid preference shares of Sangathan Ltd. for every 5 preference shares held by them and Rs. 50,000 cash.
3. The debenture holders of Mahesh Ltd. will be given 12% debentures of Rs. 100 each of Sangathan Ltd. at a discount of 10% to discharge their liability at 8% premium.
4. Rs. 14,000 cash to Mahesh Ltd.
5. Preliminary expenses amounted to 10,000.

Sangathan Ltd. issued the remaining equity shares to the public at a premium of Rs. 20 per share, which was fully paid up.

From the above information you are required to make necessary calculations in the books of both old companies and prepare necessary accounts in the books of Mahesh Ltd and prepare balance sheet of Sangathan Ltd. by assuming that the amalgamation is in the form of "PURCHASE" as per accounting standard -14

OR

- Q.1 From the above information of Mahesh limited and Bharat you are required to make necessary calculations in the books of both old companies and write journal entries and prepare balance sheet of Sangathan Ltd. by assuming that the amalgamation is in the form of "MERGER" as per accounting standard -14

- Q.2 The Balance Sheets of Dhara and Hetvi Ltd. as on 31/03/2021 are as under :

(20)

| Liabilities | Dhara Ltd. Rs. | Hetvi Ltd. Rs. | Assets | Dhara Ltd. Rs. | Hetvi Ltd. Rs. |
|--|-----------------|-----------------|------------------|-----------------|-----------------|
| Paid up share Capital equity Rs. 50 fully paid | 3,00,000 | 1,80,000 | Goodwill | 50,000 | 30,000 |
| Share premium | 50,000 | 40,000 | Building | 1,50,000 | 90,000 |
| Capital reserve | 1,00,000 | 20,000 | Plant | 3,00,000 | 80,000 |
| Profit and Loss | 40,000 | 10,000 | Investments | 50,000 | 40,000 |
| 8% Debentures | 1,00,000 | 80,000 | Furniture | — | 50,000 |
| Creditors | 50,000 | 40,000 | Stock | 50,000 | 30,000 |
| Bills payable | 15,000 | 20,000 | Bank balance | 30,000 | 25,000 |
| Outstanding salary | 25,000 | — | Bills receivable | 25,000 | 15,000 |
| | | | Debtors | 25,000 | 30,000 |
| | 6,80,000 | 3,90,000 | | 6,80,000 | 3,90,000 |

On 1/04/2021, Hetvi Ltd. was absorbed by Dhara Ltd. as per following conditions :

1. All the assets (except bank) and Liabilities of Hetvi Ltd. are to be taken over. The assets and liabilities of Hetvi Ltd. have been valued as under :
2. Building Rs. 81,000, Plant Rs. 88,000, Investments Rs. 35,000, Furniture Rs. 60,000, Stock Rs. 25,000, Bills receivable Rs. 15,000, Debtors Rs. 27,000, Creditors Rs. 43,000, Bills payable Rs. 18,000.
3. The debenture holder of Hetvi Ltd. were to be allotted such debentures at 25% premium in Dhara Ltd. decreasing interest 10%.
4. Equity shareholders of Hetvi Ltd. should be given 3 equity shares of Dhara Ltd. as per 5 shares held by them and to pay Rs. 25 in cash for each share.
5. The liquidation expenses of Hetvi Ltd. Rs. 5,000, is to be borne by Dhara Ltd.
6. Dhara Ltd. made a public issue for 2,000 shares at the premium of 10% for the purpose to pay the above purchase consideration and public issue have been fully subscribed and paid.

From the above information prepare :

Necessary accounts in the books of Hetvi Ltd. And prepare Balance sheet of Dhara Ltd. after absorption.

OR

Q.2 The following are the Balance Sheets of Arti Limited and Krishna Limited as on 31-3-2021:

| Liabilities | Arti Ltd. Rs. | Krishna Ltd. Rs. | Assets | Arti Ltd. Rs. | Krishna Ltd. Rs. |
|--|------------------|---------------------|------------------------------------|------------------|---------------------|
| Paid up share Capital: Equity shares of Rs. 100 fully paid | 8,00,000 | --- | Fixed Assets | 10,80,000 | 6,00,000 |
| Equity shares of Rs. 100 each. Rs. 50 paid up | --- | 6,00,000 | Investments (M.V. Rs. 1,00,000) | --- | 90,000 |
| General reserve | 1,00,000 | --- | Current Assets | 3,60,000 | 2,88,000 |
| 10% Debentures | 3,00,000 | 2,00,000 | Preliminary Exp. | 60,000 | 22,000 |
| Creditors | 3,00,000 | 3,00,000 | P. & L. A/c | --- | 1,00,000 |
| | 15,00,000 | 11,00,000 | | 15,00,000 | 11,00,000 |

On 1-4-2021 Arti Limited agreed to absorb Krishna Limited on the following conditions :

- The fixed assets of Arti Limited as shown in the books are 10% less than the market value whereas the current assets of Krishna Limited includes stock worth Rs. 88,000 which is over valued by 10%.
- The purchase consideration was to be satisfied by issue of three fully paid equity shares of Arti Limited in exchange of ten equity shares of Krishna Limited on the basis of intrinsic value of their shares and balance amount in cash.

Prepare ledger accounts in the books of Krishna Limited and prepare Balance sheet of arti Ltd. after absorption.

Q.3 On 31/03/2021, the Balance Sheet of Shruti Limited was as under :

| Liabilities | Rs. | Assets | Rs. |
|--|-----------------|-------------------|-----------------|
| Issued Share Capital : | | Goodwill | 55,000 |
| 500 6% Cumulative Preference shares of Rs. 1 each | 50,000 | Sundry Assets | 1,64,500 |
| 15,000 Equity Shares of Rs. 10 each fully paid | 1,50,000 | Cash | 500 |
| 7% Debentures | 30,000 | Profit & Loss A/c | 30,000 |
| Creditors | 20,000 | | |
| | 2,50,000 | | 2,50,000 |

Preference Dividend in arrears for last four years. A scheme of Reconstruction was agreed upon as follows:

- A new Company to be formed called Rathod Limited with authorized capital of 3,25,000 Equity Shares of Re. 10 each.
- One Equity Share of 5 Rs. paid in the New Company to be issued to each Equity Share in the Old Company.
- 20 Equity Shares of 5 Rs. Paid in the New Company to be issued for each preference Shares in the Old Company.
- Preference Dividend in arrears Would not be Considered as debt
- Debenture holders to receive 2000 Equity Shares in the New Company credited as fully paid.
- Creditors to be taken over by the New Company.
- The remaining unissued shares to be taken up and paid for in fully by the Directors.
- The New Company Rathod Limited to take over assets of the Old Company subjected to writing down Sundry Assets by Rs. 40,000 and Adjusting Goodwill as required.

You are required to prepare:

- Realization Account and Shareholders Account in the books of the Shruti Company.
- Opening Entries in the books the Rathod Company.
- Balance Sheet of the Rathod Company.

OR

Q.3 You are given the following Balance – Sheet of Kaushik Limited as on 31-3-2021 :

| Balance Sheet | | | |
|---|-----------------|----------------------|-----------------|
| Liabilities | Rs. | Assets | Rs. |
| Share Capital : | | Goodwill | 1,00,000 |
| 10,000 8% Cum. Pref. Shares of Rs. 10 each Fully paid | 1,00,000 | Buildings | 90,000 |
| 2,000 Equity Shares of Rs. 100 each | 2,00,000 | Plant & Machinery | 1,50,000 |
| General Reserve | 50,000 | Stock | 50,000 |
| Profit & Loss A/c | 30,000 | Debtors | 52,000 |
| 6% Debentures | 80,000 | Less: B.D. Reserve | <u>-2,000</u> |
| Creditors | 40,000 | Bills receivable | 10,000 |
| | | Bank Balance | 45,000 |
| | | Preliminary Expenses | 5,000 |
| | 5,00,000 | | 5,00,000 |

A new company Prakash Limited was formed on 1-4-2021 to take over the business of Kaushik Limited except Bank balance.

The following terms were agreed upon:

1. One Equity share of Rs. 100 each fully paid in the new company to be issued for every 8% Cum Pref. Share in the old company.
2. 4 Equity shares of Rs. 100 each fully paid in the new company to be issued for every 5 Equity shares in the old company.
3. The debenture holder of the old company to be issued sufficient 7% Debentures of the new company so as to give them a premium of 5%.
4. Expenses of liquidation which amounted to Rs. 3,000 are to be borne by the new company and paid for in cash.
5. Bills receivable are not taken over by the new company and Rs. 8,000 was realized from these bills.

You are required to prepare necessary ledger accounts and write journal entries in the books of Kaushik Limited. And prepare make necessary entries and balance sheet in the books of Prakash limited

Q.4 Neel Ltd. made a public issue of 10,00,000 shares of Rs. 10 each.

(15)

- Underwriters have agreed as under:
- Dev : 40%,
- Das : 30%,
- Hari : 20%,
- Lal : 10%

Applications were received 9,50,000 shares, which included marked application as below:

- Dev: 4,50,000 shares,
- Das: 1,90,000 shares
- Hari: 1,60,000 shares,
- Lal: 1,00,000 shares

Underwriters were entitled for 5% commission.

Prepare statement showing net liability of each underwriter and write journal entries in the books of Neel Ltd.

OR

Q.4 Explain the meaning of underwriting commission and provisions of companies act regarding it.

B.Com. Semester - 4 (CBCS) Examination
March/April-2023 [NEW COURSE]
Income Tax Law and Practice - 2(Core)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન ૧ શ્રી આનંદા દેવની નીચેની માહિતી માંથી આકારણી વર્ષ 2022-23 માટે કર જવાબદારીઓ અને કરપાત્ર આવકની ગણતરી કરો. (૨૦)

1. પગારની આવક રૂ. 4,87,500 છે.
2. વેપાર અને વ્યવસાયની આવક રૂ. 3,10,000
3. પ્રકાશિત પુસ્તક પરની રોયલ્ટી રૂ. 90,000 છે.
4. ઘરની મિલકત માંથી ભાડું રૂ. 60,000 છે.
5. અન્ય મુક્તિ આવક રૂ. 15,200 છે.
6. બેંક વ્યાજ રૂ. 27,000 છે. (TDS 10%)
7. સગીર પુત્રની આવક રૂ. 45,000 છે.
8. લાંબા ગાળાનો મૂડી લાભ રૂ. 90,000 છે.
9. P.P.F.માં યોગદાન રૂ. 90,000 છે.
10. જીવન વીમા પ્રીમિયમ ચૂકવેલ રૂ. 30,000 છે.
11. આરોગ્ય વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવેલ રૂ. 24,000 છે.

અથવા

પ્રશ્ન ૧ શ્રી અરવિંદા દેવની વર્ષ 2021-22 (A.Y. 2022-23) માટે કરપાત્ર આવક અને કર જવાબદારીની ગણતરી કરો.

1. કુલ પગાર રૂ. 7,00,000.
2. ઘરની મિલકતમાંથી ભાડું રૂ. 1,20,000.
3. બેંક ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ રૂ. 10,800 છે. (TDS 10%)
4. ઘોડાની દોડમાંથી આવક (કુલ) રૂ. 40,000 છે.
5. કૃષિ આવક રૂ. 40,000 છે.
6. લાંબા ગાળાની મૂડી ખોટ રૂ. (-25,000).
7. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન રૂ. 60,000 છે.
8. કિશાન વિકાસ પત્ર (KVP) પર વ્યાજ રૂ. 10,000.
9. LIC પ્રીમિયમ ચૂકવેલ રૂ. 20,000.

પ્રશ્ન ૨ નીચેની વિગતોમાંથી આકારણી વર્ષ : 2022-23 માટે શ્રી બીબી બુઆના કરને પાત્ર મૂડી લાભોની ગણતરી કરો. (૨૦)

| ક્રમ નંબર | તારીખ | વેચાણ કિંમત રૂ. | ટ્રાન્સફર ચાજ રૂ. | ખરીદીની કિંમત રૂ. | સંપત્તિની વિગતો | ઈન્ડેક્સની વિગતો |
|-----------|----------|-----------------|-------------------|-------------------|--------------------------|------------------|
| 1 | 1-1-1990 | 44,07,000 | 23,000 | 3,00,000 | સ્વ-કબજાનું એકમાત્ર મકાન | 100 |
| 2 | 1-6-2017 | 4,70,880 | - | 1,62,560 | રિલાયન્સ લિમિટેડના શેર | 272 |
| 3 | 1-3-2016 | 2,62,400 | 4,000 | 2,64,000 | અરવિંદ લિમિટેડના શેર | 254 |

| | | | | | | |
|---|----------|-----------|--------|-----------|---------------------------------------|-----|
| 4 | 1-9-2007 | 36,52,100 | 11,000 | 14,04,000 | જવેલરી | 129 |
| 5 | 1-1-2021 | - | - | 8,76,000 | સ્વ-નિવાસ માટે રહેણાંક-મકાન (નવું) | |

તેણે 14-3-2022ના રોજ જૂનું સ્વ-કબજાનું મકાન વેચી દીધું હતું. નાણાકીય વર્ષ 2021-22નો ઈન્ડેક્સ 317 છે (1-4-2001ના રોજ ઈન્ડેક્સ 100 હતો)

1-4-2001 ના રોજ, સ્વ-કબજાના ઘર અને ઝવેરાતની વાજબી બજાર કિંમતો રૂ. 12,00,000 અને રૂ.12,50,000 અનુક્રમે. બંને કંપનીઓના શેર (સીધા 1-11-2021ના રોજ વેચાયા) સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) ને આધીન ન હતા.

અથવા

પ્રશ્ન.૨ શ્રી બડી બુઆની આવકની નીચેની વિગતો પરથી આકારણી વર્ષ 2022-23 માટે મૂડી લાભ હેઠળ તેમની આવક નક્કી કરો:

- શ્રી બડી બુઆએ 1-1-2008 ના રોજ રૂ. 4,68,000. માં રહેણાંક મકાન ખરીદ્યું હતું. તેણે આ ઘર 1-4-2021 ના રોજ રૂ. 17,13,000 માં વેચ્યું. છે. તેની માલિકીનું આ એકમાત્ર ઘર હતું. વેચાણની આવકનો એક ભાગ તેમણે તેમના પુત્રના શિક્ષણ માટે વાપર્યો હતો અને રૂ. 31-12-2021 ના રોજ અન્ય રહેણાંક મકાન ખરીદવા માટે રૂ. 5,70,000 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો..
- 31-12-2021 ના રોજ, તેણે કેટલીક સિક્યોરિટીઝ રૂ. 3,28,525 માં વેચી. જે તેમણે 1-3-2006 ના રોજ રૂ. 65,400 માં ખરીદ્યા હતા. રૂ. 1,00,000 ના વેચાણ કિંમતના રોકાણ 1-2-2022 ના રોજ 3 વર્ષના બોન્ડમાં કરવામાં આવ્યું હતું. (સરકાર દ્વારા સૂચિત)

લાંબા ગાળાના મૂડી લાભ માટે સંબંધિત ખર્ચ સૂચકાંક નીચે મુજબ છે:

| | | |
|------|---------|-----|
| P.Y. | 2005-06 | 117 |
| P.Y. | 2007-08 | 129 |
| P.Y. | 2021-22 | 317 |

પ્રશ્ન.૩ શ્રી જોગીયાની નીચેની માહિતી પરથી, નાણાકીય વર્ષ 2021-22 માટે "અન્ય સ્ત્રોતોમાંથી આવક" શીર્ષક હેઠળ તેમની કરપાત્ર આવકની ગણતરી કરો. (૧૫)

| ક્રમ નંબર | આવકની વિગતો | રૂ. |
|-----------|--|----------|
| 1 | ભારતીય કંપનીઓના 10% પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ પ્રાપ્ત થયું | 20,000 |
| 2 | બેંક ઓફ ઇન્ડિયામાં ફિક્સ ડિપોઝિટ પર મળતું વ્યાજ | 18,600 |
| 3 | 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ્સ પર વ્યાજ. | 7,000 |
| 4 | પેટા ભાડૂત પાસેથી ભાડાની આવક | 12,000 |
| 5 | ઘોડા-દોડમાંથી જીતવા પર ચોખ્ખી આવક (TDS 30%) | 1,40,000 |
| 6 | વિદેશી કંપનીઓના શેર પર મળેલ ડિવિડન્ડ | 8,400 |
| 7 | રીમા લિમિટેડના 10% કરમુક્ત ડિબેન્ચર પર વ્યાજ મળે છે. (TDS 10%) | 27,000 |
| 8 | પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં વ્યાજ જમા | 5,400 |
| 9 | કુટુંબ પેન્શન મેળવ્યું | 2,70,000 |

તેણે કંપનીઓના શેર ખરીદવા માટે લેવામાં આવેલી બેંક લોન પર વ્યાજ રૂ. 6,500 ચૂકવેલ છે. બેંક કમિશન રૂ. 600 વ્યાજની વસૂલાત માટે ચૂકવવામાં આવ્યા હતા.

અથવા

પ્રશ્ન.૩ (A) એડવાન્સ ટેક્સ શું છે? એક્ટ મુજબ એડવાન્સ ટેક્સની જોગવાઈઓ સમજાવો.

(B) કલમ 234A, 234B, 234C હેઠળ વ્યાજ પર નોંધ લખો.

પ્રશ્ન.૪ GST નોંધણી પ્રક્રિયા અને GST ના લાભ સમજાવો

(૧૫)

અથવા

પ્રશ્ન.૪ ઇનપુટ ટેક્સ ક્રેડિટના ખ્યાલને વિગતવાર સમજાવો અને કાલ્પનિક આંકડાઓ સાથે યોગ્ય ઉદાહરણ સમજાવો.

ENGLISH VERSION

Que.1 From the following information of Mr. Ananda Dev compute tax Liabilities and taxable income (20) for the assessment year 2022-23.

1. Salary income Rs. 4,87,500
2. Business and profession income Rs. 3,10,000
3. Royalty on book published Rs. 90,000
4. Rent from house property Rs. 60,000
5. Other Exempted income Rs. 15,200
6. Bank Interest (TDS -10%) Rs. 27,000
7. Income of Minor son Rs. 45,000
8. Long term capital gain Rs. 90,000
9. Contribution to P.P.F. Rs. 90,000
10. Life insurance premium paid Rs. 30,000
11. Health insurance premium paid Rs. 24,000

OR

Que.1 Compute taxable income and tax liability of Mr. Arvinda Dev for the year 2021-22 (A.Y. 2022-23)

1. Gross salary Rs. 7,00,000
2. Rent from House property Rs. 1,20,000
3. Interest on bank Fixed Deposit (TDS 10%) RS. 10,800
4. Income from Horse race (gross) Rs. 40,000
5. Agriculture income Rs. 40,000
6. Long Term Capital Loss Rs. (-25,000)
7. Short Term Capital gain Rs. 60,000
8. Interest on Kishan Vikas Patra (KVP) Rs. 10,000
9. LIC Premium paid Rs. 20,0000

Que.2 Compute the capital gains chargeable to tax of Mr. Bobby Bua from the following details for the A.Y. 2022-23 (20)

| Sr. No. | Date of Purchase | Selling Price Rs. | Transfer Charges Rs. | Cost Rs. | Particulars of Assets | Index of year of purchase |
|---------|------------------|-------------------|----------------------|-----------|---|---------------------------|
| 1 | 1-1-1990 | 44,07,000 | 23,000 | 3,00,000 | Only self-occupied house | 100 |
| 2 | 1-6-2017 | 4,70,880 | - | 1,62,560 | Shares of Reliance Ltd. | 272 |
| 3 | 1-3-2016 | 2,62,400 | 4,000 | 2,64,000 | Shares of Arvind Ltd. | 254 |
| 4 | 1-9-2007 | 36,52,100 | 11,000 | 14,04,000 | Jewelry | 129 |
| 5 | 1-1-2021 | - | - | 8,76,000 | Residential house for self-occupation (New) | |

He had sold old self-occupied house on 14-3-2022. The cost inflation index of financial year 2021-22 is 317 (CIF as on 1-4-2001 was 100)

On 1-4-2001, the fair market values of self-occupied house and jewelry were Rs. 12,00,000 and Rs. 12,50,000 respectively. Shares of both the companies (Sold directly on 1-11-2021) were not subject to securities transaction tax (STT)

OR

Que.2 From the following particulars of income of Mr. Buffy Bua determine his income under the head capital gain for the assessment year 2022-23:

1. Mr. Buffy Bua had purchased a residential house for Rs. 4,68,000 on 1-1-2008. He sold this house on 1-4-2021 for Rs. 17,13,000. This was the only house owned by him. A part of the sale proceeds was utilised by him for the education of his son and Rs. 5,70,000 was used on 31-12-2021 to acquire another residential house.
2. On 31-12-2021, he sold some of the securities for Rs. 3,28,525 which were purchased by him on 1-3-2006 for Rs. 65,400. Rs. 1,00,000 of the sales prices was invested on 1-2-2022 in 3 years bond (notified by the government)

Relevant cost index for long term capital gain are as follows:

| | | |
|------|---------|-----|
| P.Y. | 2005-06 | 117 |
| P.Y. | 2007-08 | 129 |
| P.Y. | 2021-22 | 317 |

Que.3 From the following information of Mr. Jogiya, Compute his taxable income under the head of "Income from other Sources" for the financial year 2021-22. (15)

| Sr. No. | Particulars of Income | Rs. |
|---------|--|----------|
| 1 | Dividend received on 10% Preference shares of Indian Companies | 20,000 |
| 2 | Interest earned on fixed deposit with Bank of India | 18,600 |
| 3 | Interest on 7% Capital Investment Bonds. | 7,000 |
| 4 | Income from rent from sub-tenant | 12,000 |
| 5 | Net income received on winning from horse-race (TDS 30%) | 1,40,000 |
| 6 | Dividend received on shares of foreign companies | 8,400 |
| 7 | Interest received on 10% tax free debenture of Rima Ltd. (TDS 10%) | 27,000 |
| 8 | Interest credited in Public Provident Fund account | 5,400 |
| 9 | Received family pension | 2,70,000 |

He has paid interest of Rs. 6,500 on bank loan taken for purchasing shares of Indian Companies. Bank Commission of Rs. 600 was paid for the collection of interest.

OR

Que.3 (A) What is advance tax? Explain the provisions of Advance tax according to Act. (10)

(B) Write a note on Interest under section 234A, 234B, 234C (05)

Que.4 Explain the GST registration procedure and benefit of GST (15)

OR

Que.4 Explain in detail the concept of Input Tax credit and explain suitable example with imaginary figures.

B.Com. Semester - 4 (CBCS) Examination
March/April-2023 [NEW COURSE]
Cost Accounting - 2(Core)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ સમર લિમિટેડે 2022ના વર્ષ માં 10,000 એકમોનું ઉત્પાદન કરીને વેચાણ કર્યું. જેની વિગતો નીચે (૨૦) મુજબ એકમ દીઠ વેચાણ કિંમત રૂ. 200 છે.

| વિગત | રકમ (રૂ.) |
|-------------------------|-----------|
| માલસામાન | 7,00,000 |
| પ્રત્યક્ષ મજૂરી | 3,50,000 |
| પ્રત્યક્ષ ખર્ચા | 50,000 |
| કારખાના ખર્ચ (40% ચલિત) | 3,50,000 |
| ઓફિસ ખર્ચા (સ્થિર) | 1,40,000 |
| વેચાણ ખર્ચ (70% ચલિત) | 1,60,000 |
| કુલ | 17,50,000 |

વર્ષ 2023 માં 30,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ અંદાજેલ છે. વધારાની માહિતી નીચે મુજબ છે.

1. પ્રત્યક્ષ મજૂરી એકમદીઠ 20% વધશે.
2. સ્થિર કારખાના ખર્ચ રૂ. 3,00,000 વધશે.
3. ઓફિસ ખર્ચા 25% વધશે.
4. ચલિત વેચાણ ખર્ચ એકમદીઠ રૂ. 0.80 વધશે.
5. પડતર ઉપર 25% નફો અંદાજેલ છે.

તૈયાર કરો: (1) 2022 ના વર્ષ નું કુલ અને એકમદીઠ પડતર પત્રક.
 (2) 2023 ના વર્ષ નું અંદાજી પડતરપત્રક.

અથવા

પ્રશ્ન.૧ કવિ કંપની અત્યારે બે પ્રકાર ના કમ્પ્યુટર નું ઉત્પાદન કરે છે X અને Y 31 મી માર્ચ 2022 ના રોજ પૂરા થતાં વર્ષની વિગતો નીચે પ્રમાણે છે.

| | | | |
|--------------------|--------------|-----------------|--------------|
| પ્રત્યક્ષ માલસામાન | રૂ.10,00,000 | પ્રત્યક્ષ મજૂરી | રૂ.4,50,000 |
| પ્રત્યક્ષ ખર્ચા | રૂ.1,50,000 | કુલ વેચાણ | રૂ.20,00,000 |

એમ જાણવા મળ્યું છે કે...

1. X પ્રકારના કમ્પ્યુટર નો એકમદીઠ પ્રત્યક્ષ માલસામાનનો ખર્ચ Y પ્રકારના એકમદીઠ પ્રત્યક્ષ માલસામાન કરતાં બે ગણો છે.
2. Y કમ્પ્યુટરનો એકમદીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ X કમ્પ્યુટરના એકમદીઠ મજૂરી ખર્ચ ના 40 % છે.
3. પ્રત્યક્ષ ખર્ચાઓ X અને Y બંને પ્રકારના કમ્પ્યુટરના ઉત્પાદનના પ્રમાણમાં હતા.
4. કારખાનાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 20% હતા.
5. વહીવટી ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 50% હતા.
6. X કમ્પ્યુટરના 5,000 એકમોનું ઉત્પાદન થયું હતું, જેમાંથી 80% વેચાયા હતા, જ્યારે Y કમ્પ્યુટર ના 8,000 એકમો વેચાયા હતા જે ઉત્પાદન ના 80% હતા.
7. વેચાણ ખર્ચા કમ્પ્યુટર X માટે એકમદીઠ રૂ. 8 અને કમ્પ્યુટર Y માટે એકમદીઠ રૂ.9 હતા.
8. X કમ્પ્યુટરની એકમદીઠ વેચાણ કિંમત Y કમ્પ્યુટર ની એકમદીઠ વેચાણ કિંમત કરતાં બમણી હતી.

તૈયાર કરો : કુલ પડતર અને નફો તથા એકમદીઠ પડતર અને નફો.

પ્રશ્ન.૨ જય કંપની ની એકમદીઠ પડતર નીચે મુજબ બનેલી છે.

- ❖ માલસામાન ખર્ચ રૂ.૨૦, મજૂરી ખર્ચ રૂ.૧૫, કારખાના શિરોપરી ખર્ચ પ્રાથમિક પડતર ના ૨૦%.
- ❖ ઓફિસ શિરોપરી ખર્ચ રૂ.૩., વેચાણ અને વિતરણ શિરોપરી ખર્ચ રૂ.૨. કંપનીનું નફા નુકશાન ખાતું નીચે મુજબ હતું.

| વિગત | રકમ રૂ. | વિગત | રકમ રૂ. |
|---------------------------------------|------------|--------------------------------|-----------|
| તૈયાર માલનો શરૂનો સ્ટોક (૧૫૦૦ એકમ) | ૭૫,૦૦૦ | વેચાણ | ૧૩,૫૦,૦૦૦ |
| માલસામાન | ૬,૦૦,૦૦૦ | આખર માલનો સ્ટોક (૪,૫૦૦ એકમ) | ૨,૧૦,૦૦૦ |
| મજૂરી ખર્ચ | ૪,૫૦,૦૦૦ | મળેલ વ્યાજ અને ડિવિડંડ | ૧૨,૦૦૦ |
| કારખાના ખર્ચ | ૨,૨૫,૦૦૦ | મળેલ વટાવ | ૩,૦૦૦ |
| ઓફિસ ખર્ચ | ૯૭,૫૦૦ | | |
| વેચાણ ખર્ચ | ૫૨,૫૦૦ | | |
| માંડી વાળેલી પાછડી | ૭,૫૦૦ | | |
| પ્રાથમિક ખર્ચ | ૪,૫૦૦ | | |
| કરવેરાની જોગવાઈ | ૩,૦૦૦ | | |
| ચોખ્ખો નફો | ૬૦,૦૦૦ | | |
| કુલ | ૧૫,૭૫,૦૦૦. | કુલ | ૧૫,૭૫,૦૦૦ |

પડતર પત્રક અને મેળવણી પત્રક તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.૨ તા. ૩૧ મી માર્ચ ૨૦૨૨ ના રોજ પૂરા થતાં વર્ષના યામિની લી.ના નાણાકીય હિસાબો માથી નીચે મુજબની વિગતો મળેલ છે.

| | | | |
|--------------------|-----------|-------------------------------------|----------|
| કાચામાલ નો વપરાશ | ૬,૨૮,૦૦૦ | પ્રત્યક્ષ મજૂરી | ૧,૨૧,૫૦૦ |
| કારખાનાના ખર્ચ | ૯૬,૦૦૦ | ઓફિસ ખર્ચ | ૧,૬૦,૦૦૦ |
| વેચાણ ખર્ચ | ૮૫,૦૦૦ | ચંત્ર વેચાણનું નુકશાન | ૪,૦૦૦ |
| મળેલું ભાડું | ૬,૦૦૦ | માંડી વાળેલ ડીબેચર વટાવ | ૨,૦૦૦ |
| વેચાણ (૭,૩૦૦ એકમો) | ૧૩,૦૦,૦૦૦ | તૈયાર માલનો આખર સ્ટોક (૨૦૦ એકમો) | ૨૬,૦૦૦ |

પડતરના હિસાબોમા માલસામાન અને મજૂરી ખર્ચ તેની પડતર કિમતે દર્શાવવામાં આવેલ છે. જ્યારે કારખાના ખર્ચ, પ્રત્યક્ષ મજૂરીના ૭૫% લેખે વસૂલ કરવામાં આવે છે. ઓફિસ ખર્ચ, કારખાનાની પડતરના ૨૦% વસૂલ કરવામાં આવે છે તથા વેચાણ ખર્ચ વેચેલ એકમદીઠ રૂ. ૧૨ લેખે ગણેલ છે. વર્ષની શરૂઆતમાં તૈયારમાલનો કોઈ સ્ટોક ન હતો.

તૈયાર કરો: (૧) પડતર પત્રક

(૨) નાણાકીય હિસાબો મુજબ વેપાર-નફાનુકશાન ખાતું

(૩) પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોનું મેળવણી પત્રક.

પ્રશ્ન.૩ કોન્ટ્રાક્ટર રાધિકા પાસે રૂ.15,00,000 નો કરાર છે.તેને વખતોવખત પ્રમાણિત કામનાં 90% રોકડ મળે (૧૫) છે.આ કરાર ને લગતી વિગતો નીચે મુજબ છે.

| વિગત | 2020 રૂ. | 2021 રૂ. | 2022 રૂ. |
|-----------------|----------|-----------|-----------|
| માલસામાન | 1,80,000 | 2,20,000 | 1,26,000 |
| મજૂરી | 1,70,000 | 2,30,000 | 1,70,000 |
| પ્રત્યક્ષ ખર્ચા | 7,000 | 25,000 | 9,000 |
| આડકતરા ખર્ચા | 3,000 | 4,000 | ---- |
| પ્રમાણિત કામ | 3,50,000 | 11,40,000 | 15,00,000 |
| અપ્રમાણિત કામ | ----- | 20,000 | ---- |
| આપેલ ચંત્ર | 20,000 | ----- | ---- |

વર્ષ 2020, 2021 અને 2022ને અંતે ચંત્રની કિંમત અનુક્રમે રૂ.16,000, રૂ.10,000 અને રૂ.4,000 હતી. ઉપરની વિગતો પરથી કરાર ખાતાં અને ચાલુકામ ખાતાં તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.૩ સાક્ષી કન્સ્ટ્રક્શન કંપનીએ 'સહકાર બ્રિજ' બાંધવાનો કરાર રૂ.10,00,000 માં લીધો અને તા.1-5-2022 ના રોજ કરાર શરૂ કર્યો. કરારની તા.31-12-2022 ના રોજની વિગતો નીચે પ્રમાણે છે.

| વિગત | રકમ રૂ. | વિગત | રકમ રૂ. |
|-------------------------|----------|--------------------------------|----------|
| કરાર માટે ખરીદેલ માલ | 71,000 | માલસ્ટોક (તા.31-12-2022) | 10,000 |
| સ્થળ પર મોકલેલ માલ | 2,00,000 | કરાર અંગે રોકડ મળી | 5,06,250 |
| મજૂરી | 1,96,000 | પ્રમાણિત નહિ થયેલ કામ | 10,000 |
| માલસામાન પરત મોકલ્યો | 2,000 | આડકતરા ખર્ચાનો પ્રમાણસર ભાગ | 6,000 |
| અન્ય કરાર પર મોકલેલ માલ | 4,000 | કરારની જગ્યા પર મોકલેલા ચંત્રો | 30,000 |

પ્રમાણિત કામના 75% રકમ મળી બાકીના કામ પૂર્ણ થયે. તા.31-12-2022 ના રોજ કરાર પર મથીનરી રૂ. 20,000ની હતી. રોકડનાં ધોરણે નફાના 2/3 ભાગની રકમ ન.નું.ખાતે લઈ જવી.

તૈયાર કરો : કરાર ખાતું, ચાલુકામ ખાતું અને કરાર આપનારનું ખાતું.

પ્રશ્ન.૪ નીચેની માહિતી હાર્દિક એન્જિનિયરીંગ કંપનીમાથી લેવામાં આવી છે. (૧૫)

| | | | |
|-----------------------|-----------|-------------------------|-----------|
| માલસામાન | રૂ.12,500 | ફેક્ટરીના ખર્ચા (સ્થિર) | રૂ. 5,000 |
| મજૂરી | રૂ. 8,750 | વહીવટી પરોક્ષ ખર્ચા | રૂ. 6,500 |
| ફેક્ટરીના ખર્ચા(ચલિત) | રૂ. 6,250 | યાંત્રિક કલાકો | 7,500 |

ફેક્ટરીનાં પરોક્ષ ખર્ચાઓ યાંત્રિક કલાકોનાં આધારે સમાવવામાં આવે છે.તથા વહીવટી ખર્ચા કારખાના પડતરને આધારે સમાવવામાં આવે છે.

કંપની એક જોબનો ઓર્ડર પ્રાપ્ત કરે છે. જોબને લગતી માહિતી નીચે પ્રમાણે છે.

માલસામાન રૂ.1875, મજૂરી રૂ.875, યાંત્રિક કલાકો રૂ.750

ઉપરની માહિતીના આધારે જોબ નં 111 નું પડતર પત્રક તૈયાર કરો.

અથવા

Q1 (A) ચીઝ નં.0002 વાણી ફોલો થીંડી યજ્ઞ સંગ્રહણકારી સમિતી વચ્ચે નાં (B)નાથની (10)
 ગણતરી માલ છે. ₹ 25,000

સાલગણના
 ગણતરી-A 60 સેલ્સ, સેલ્સ ₹ 40
 ગણતરી-B 70 સેલ્સ, સેલ્સ ₹ 60
 ગણતરી-C 70 સેલ્સ, સેલ્સ ₹ 20
 ગણતરી-C માં ગણતરી માલ ફોલો યજ્ઞ સંગ્રહણકારી સમિતી છે.
 ચીઝ સંગ્રહણકારી માલ ગણતરી-A ₹ 90,000, 10,000 સમિતી સેલ્સ માં
 માલ ગણતરી-B માલ : ગણતરી-A ₹ 1,80,000, 20,000 સમિતી સેલ્સ માં
 ગણતરી-B ₹ 1,80,000, 30,000 સમિતી સેલ્સ માં
 ગણતરી-C ₹ 2,70,000, 30,000 સમિતી સેલ્સ માં
 ગણતરી-C માલ 5,000 સમિતી સમ નાં સેલ્સ માં સેલ્સ ₹ 1,80,000.
 ચીઝ નં. 0002 નાં સેલ્સ વચ્ચે સંગ્રહણકારી સમિતી.
 (10)

Q1 (B) ચીઝ વચ્ચે વચ્ચેના સેલ્સ સંગ્રહણકારી સમિતી.
ENGLISH VERSION
 The particulars are as under (20)

| Particulars | Rs. |
|---------------------------------|-----------|
| Materials | 7,00,000 |
| Direct Wages | 3,50,000 |
| Direct Expenses | 50,000 |
| Factory Expenses (40% Variable) | 3,50,000 |
| Office Expenses (Fixed) | 1,40,000 |
| Office Expenses (70% Variable) | 1,60,000 |
| Selling Expenses | 17,50,000 |
| Total | 17,50,000 |

The additional production and sales is estimated at 30,000 units.

During the year 2023 production and sales is estimated at 30,000 units. Information is as under:
 1. Direct wages per unit will increase by 20%.
 2. Fixed factory expenses will increase by Rs.3,00,000.
 3. Office expenses will increase by 25%.
 4. Variable selling expenses will rise by Rs.0.80 per unit.
 5. 25% profit is estimated cost.
 Prepare: (1) Statement of cost per unit and total cost of 2022.
 (2) Estimated cost Statement (Tender) of 2023.
OR

Q1 Kavi computer Ltd. Manufacturer two types of computer 'X' and 'Y'. the particulars for the year ended 31st march 2022 was as follows:

| Particulars | Direct Wages | Sales |
|------------------|--------------|-----------|
| Direct materials | 10,00,000 | 20,00,000 |
| Direct expenses | 1,50,000 | |

On the study it is ascertained that...
 1. Direct material per unit in 'X computer' consists twice as much as that in type 'Y' computer.
 2. Direct wages Computer unit for Y computer were 40% of those for X computer.
 3. Direct expenses were same per unit for Y as well as Y computer.
 4. Factory overheads were 20% of the prime cost.
 5. Administrative overheads were 50% of the direct wages.
 6. 5,000 units of X computer were produced of which 80% were sold and 8,000 units of Y computer were sold which was 80% of production.
 7. Selling overheads were Rs.8 per unit for X computer and Rs. 9 per unit for Y computer.
 8. Selling price per unit for X computer was double than Y computer.
 Prepare: A statement showing cost and profit in total and per unit for X computer and Y computer.

Q2 Following is the cost per unit of Jay Co.
 ❖ Material expenses Rs.20, Wages Rs.15, Factory overheads 20% of the Prime Cost
 ❖ Office expenses Rs.3, Selling and distribution overheads Rs.2.
 Following is the Profit and Loss Account (20)

| Particular | Rs. | Particular | Rs. |
|--|-----------|---|-----------|
| To opening stock (Finished goods 1500 units) | 75,000 | By Sales | 13,50,000 |
| Material expenses | 6,00,000 | Closing stock of finished goods (4,500 units) | 2,10,000 |
| Wages | 4,50,000 | Interest & dividend | 12,000 |
| Factory expenses | 2,25,000 | Discount received | 3,000 |
| Office Expenses | 97,500 | | |
| Selling expenses | 52,500 | | |
| Goodwill written off | 7,500 | | |
| Preliminary Exp written off | 4,500 | | |
| Provision for taxation | 3,000 | | |
| Net Profit | 60,000 | | |
| | 15,75,000 | | 15,75,000 |

Prepare statement of Cost and Reconciliation Statement.

Q2 Following information have been obtained from the Financial accounts of Y smit Ltd. For the year ending on 31st march 2022:

| Particular | Rs. | Particular | Rs. |
|------------------------------|-----------|---|----------|
| Consumption of raw-materials | 6,28,500 | Direct Wages | 1,21,500 |
| Factory expenses | 96,000 | Office exp | 1,60,000 |
| Selling exp | 85,000 | Loss on sale of machinery | 4,000 |
| Rent received | 6,000 | Discount on debenture written off | 2,000 |
| Sales (7,300 units) | 13,00,000 | Closing stock of finished goods (200 units) | 26,000 |

The Cost Accounts show that raw-materials and wages are charged at actual cost, while factory expenses are charged at 75% of wages and office expenses are received at 20% of factory cost and selling expenses are charged at Rs. 12 per unit sold. There was no stock of finished goods in the beginning of the year.
 Prepare:(1) A cost-sheet.
 (2) Trading and Profit & Loss Account as per financial accounts.
 (3) Reconciliation statement of Cost and Financial Accounts.

Q3 Rashika contractor have the following information relates to contract for Rs.15, 00,000. The contract pays 90% cash following week certified. (15)

| Particulars | 2020 | Rs. | 2021 | Rs. | 2022 | Rs. |
|-------------------|----------|-----|-----------|-----|-----------|-----|
| Materials | 1,80,000 | | 2,20,000 | | 1,26,000 | |
| wages | 1,70,000 | | 2,30,000 | | 1,70,000 | |
| Direct expenses | 7,000 | | 25,000 | | 9,000 | |
| Indirect expenses | 3,000 | | 4,000 | | --- | |
| Work certified | 3,50,000 | | 11,40,000 | | 15,00,000 | |
| Work uncertified | --- | | 20,000 | | --- | |
| plant | 20,000 | | --- | | --- | |

The value of the plant at the end of the year 2020, 2021, 2022 was Rs.16,000, Rs.10,000 and Rs.4,000 respectively. Prepare contract accounts and work-in-progress accounts from above information.

OR

- Q.3 Sakshi construction Co. Ltd. have obtain a contract for Sahakar Bridge for Rs.10,00,000 and contract was start 1-5-2022, details of contract as on dt.31-12- 2022.

| Particular | Rs. | Particular | Rs. |
|---------------------------------|----------|---------------------------------|----------|
| Material purchased | 71,000 | Material stock on dt.31-12-2022 | 10,000 |
| Material issued at site | 2,00,000 | Cash received for contract | 5,06,250 |
| Wages | 1,96,000 | Work Uncertified | 10,000 |
| Material return | 2,000 | Indirect expenses proportion | 6,000 |
| Material sent on other contract | 4,000 | Plant issued at site | 30,000 |

Cash received 75% of certified work, rest of the amount at completion. The value of the plant on dt.31-12-2022 was Rs. 20,000. Prepare contract account by considering 2/3 profit on cash basis and also prepare work-in-progress account and contractee account,

- Q.4 The following records are taken from Hardik Engineering Works Ltd.

(15)

| | | | |
|----------------------------|-----------|--------------------------|----------|
| Materials | Rs.12,500 | Fixed factory overheads | Rs.5,000 |
| Direct wages | Rs. 8,750 | Administration overheads | Rs.6,500 |
| Variable factory overheads | Rs. 6,250 | Machine hours | 7,500 |

Factory overheads are absorbed on the basis of machine hours and administrative overheads are absorbed as a percentage of work cost. The company has received an order of a job. The following particulars are available in respect of the Job No.111

Materials Rs. 1875, Wages Rs.875, Machine hours 750.

Prepare Job cost sheet.

OR

- Q.4 (A) The following information regarding Job No.007 is taken from cost account of Khush Engineering factory:

(10)

Materials Rs. 25,000

Labour: Department-A 60 hours, Rs.40 per hours

Department-B 70 hours, Rs.60 per hours

Department-C 70 hours, Rs.20 per hours

The overheads expenses regarding above three department are estimated as under:

Variable overheads: Department-A Rs.90,000 for 10,000 labour hours

Department-B Rs.1,80,000 for 20,000 labour hours

Department-C Rs.2,70,000 for 30,000 labour hours

Fixed overheads: Rs.1,80,000 for 5,000 general working hours.

Calculate total cost of Job No.007.

- (B) State advantages of Job Costing.

(05)

647510

BCM4Bc2C105x

Seat No : 420144

B.Com. Semester - 4 (CBCS) Examination
March/April-2023 [NEW COURSE]
Business Communication - 2(Core)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- Que.1 Write a detailed answer on the following questions. (Any one) (15)
- 1) What is intensive and extensive listening? Discuss in detail the advantages of good listening.
 - 2) What is public speaking? Explain appropriate method of selection of interesting speech.
- Que.2 Write a short note on the following topics. (Any two) (20)
- 1) Advantages of cell phones
 - 2) Advantages of internet
 - 3) Blog writing
 - 4) Advantages of E-mail.
- Que.3 (A) Write a detailed answer on the following questions. (Any one) (15)
- (1) What is group discussion? Discuss the opening and summarizing of a group discussion.
 - 2) Explain different types of interviews and discuss how will body language help in interview?
- Que.4 (A) Write a letter on the following. (Any one) (10)
- 1) Write a letter of complaint the goods which you received is of inferior quality.
 - 2) Write a letter of Adjustment the goods which you received is of different type.
- Que.4 (B) Write a letter on the following. (Any one) (10)
- (1) Draft a letter on behalf of the debtor to the creditor to give one-month time limit for the payment.
 - 2) Despite several reminders your debtor doesn't reply. Write a letter to take legal action against him.

B.Com. Semester - 4 (CBCS) Examination
March/April-2023 [NEW COURSE]
Accounting - 4(Elective)

Time: 2:30 Hours

Instructions:

- All questions are compulsory.
- Figures to the right indicate marks.

Marks: 70

પ્રશ્ન.૧ કૌશિક લિમિટેડનું તા.૩૧/૦૩/૨૦૨૧ ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે.

(૨૦)

| જવાબદારીઓ | રકમ રૂ. | મિલકતો | રકમ રૂ. |
|-----------------------------|----------|--------------------|----------|
| ઈક્વિટી શેરમૂડી દરેક રૂ. 10 | 2,00,000 | પાઘડી | 68,000 |
| ઈક્વિટી શેરમૂડી દરેક રૂ. 05 | 1,00,000 | કાયમી મિલકતો | 84,000 |
| અનામતો અને વધારો | 60,000 | રોકડ | 11,000 |
| ચાલુ જવાબદારી | 75,000 | સ્ટોક | 1,20,000 |
| ખર્ચ અંગેની જવાબદારીઓ | 5,000 | દેવાદારો | 1,45,000 |
| | | અગાઉથી ચૂકવેલ ખર્ચ | 2,000 |
| | | પ્રાથમિક ખર્ચા | 10,000 |
| | 4,40,000 | | 4,40,000 |

વધારાની માહિતી:

- કાયમી મિલકતોની કિંમત તેની ચોપડા કિંમત કરતા 25% વધુ આંકવાની છે.
- અપેક્ષિત વળતરનો દર 10% છે.
- 3,000 ના દેવાદારો સિવાય બાકીના દેવાદારો સધ્ધર છે. ખર્ચની જવાબદારી હવે રહેશે નહીં અને 10,000 નો બોનસનો દાવો ચૂકવવાનો થશે.
- કરવેરા બાદ છેલ્લા ચાર વર્ષનો નફો અનુક્રમે 40,000, 50,000, 60,000 અને 78,000 છે.
- પાઘડીની કિંમત, તેની ચોપડા કિંમત અને અધિક નફાની ત્રણ વર્ષની ખરીદીને આધારે ગણેલ કિંમતની સરેરાશ ગણવાની છે.

ઉપરોક્ત માહિતીને આધારે બંને પ્રકારના ઈક્વિટી શેરની આંતરિક કિંમત અને બજાર કિંમત શોધો

અથવા

પ્રશ્ન.૧ કિષ્ના લી. નું તા.૩૧/૦૩/૨૦૨૧ નું પાકું સરવૈયું નીચે મુજબ છે

200000 + 10

| જવાબદારીઓ | રકમ રૂ. | મિલકતો | રકમ રૂ. |
|---|----------|---------------------|----------|
| શેરમૂડી: | | પાઘડી | 25,000 |
| 4,000 પૂર્ણ ભરપાઈ ઈક્વિટી શેર દરેક રૂ.100 | 4,00,000 | પેટન્ટ | 4,500 |
| 10%ના પૂર્ણ ભરપાઈ પ્રેકરન્સ શેર | 1,50,000 | જમીન મકાન | 3,00,000 |
| સામાન્ય અનામત | 75,000 | -ઘસારો | -30,000 |
| | | અન્ય કાયમી મિલકતો | 3,80,000 |
| | | -ઘસારો | -50,000 |
| | | મશીનરી | 50,000 |
| | | -ઘસારો | -12,500 |
| | | રોકાણો: | |
| | | ગૌણ કંપનીના શેર | 15,000 |
| | | 10%ના પ્રેમલ લી.ના | |
| | | ડીબેન્યર મૂળ કિંમતે | 45,000 |
| | | | 60,000 |
| કામદાર વળતર ફંડ | 10,000 | | |

| | 2019 | 2020 | 2021 | 15-3-2022 |
|-------------|---------|---------|---------|-----------|
| સરકારી સંચય | 125,000 | 140,000 | 150,000 | 160,000 |
| વ્યાજ સંચય | 30,000 | 35,000 | 40,000 | 45,000 |
| વ્યાજ સંચય | 20,000 | 25,000 | 30,000 | 35,000 |
| વ્યાજ સંચય | 1,000 | 1,000 | 1,000 | 1,000 |
| વ્યાજ સંચય | 5,000 | 5,000 | 5,000 | 5,000 |
| વ્યાજ સંચય | 8,000 | 8,000 | 8,000 | 8,000 |

કુલ સંચય: 189,000

1. વ્યાજ સંચય 125,000 રૂ. થી 150,000 રૂ. થી
2. વ્યાજ સંચય 30,000 રૂ. થી 35,000 રૂ. થી
3. વ્યાજ સંચય 20,000 રૂ. થી 25,000 રૂ. થી
4. વ્યાજ સંચય 1,000 રૂ. થી 1,000 રૂ. થી
5. વ્યાજ સંચય 5,000 રૂ. થી 5,000 રૂ. થી
6. વ્યાજ સંચય 8,000 રૂ. થી 8,000 રૂ. થી

પા.ક.૩

| વ્યાજ સંચય | 2019 | 2020 | 2021 | 15-3-2022 |
|------------|---------|---------|---------|-----------|
| વ્યાજ સંચય | 125,000 | 140,000 | 150,000 | 160,000 |
| વ્યાજ સંચય | 30,000 | 35,000 | 40,000 | 45,000 |
| વ્યાજ સંચય | 20,000 | 25,000 | 30,000 | 35,000 |
| વ્યાજ સંચય | 1,000 | 1,000 | 1,000 | 1,000 |
| વ્યાજ સંચય | 5,000 | 5,000 | 5,000 | 5,000 |
| વ્યાજ સંચય | 8,000 | 8,000 | 8,000 | 8,000 |

કુલ સંચય: 189,000

પા.ક.૪

| વ્યાજ સંચય | 2019 | 2020 | 2021 | 15-3-2022 |
|------------|---------|---------|---------|-----------|
| વ્યાજ સંચય | 125,000 | 140,000 | 150,000 | 160,000 |
| વ્યાજ સંચય | 30,000 | 35,000 | 40,000 | 45,000 |
| વ્યાજ સંચય | 20,000 | 25,000 | 30,000 | 35,000 |
| વ્યાજ સંચય | 1,000 | 1,000 | 1,000 | 1,000 |
| વ્યાજ સંચય | 5,000 | 5,000 | 5,000 | 5,000 |
| વ્યાજ સંચય | 8,000 | 8,000 | 8,000 | 8,000 |

કુલ સંચય: 189,000

પા.ક.૩

| વ્યાજ સંચય | 2019 | 2020 | 2021 | 15-3-2022 |
|------------|---------|---------|---------|-----------|
| વ્યાજ સંચય | 125,000 | 140,000 | 150,000 | 160,000 |
| વ્યાજ સંચય | 30,000 | 35,000 | 40,000 | 45,000 |
| વ્યાજ સંચય | 20,000 | 25,000 | 30,000 | 35,000 |
| વ્યાજ સંચય | 1,000 | 1,000 | 1,000 | 1,000 |
| વ્યાજ સંચય | 5,000 | 5,000 | 5,000 | 5,000 |
| વ્યાજ સંચય | 8,000 | 8,000 | 8,000 | 8,000 |

કુલ સંચય: 189,000

પા.ક.૪

| વ્યાજ સંચય | 2019 | 2020 | 2021 | 15-3-2022 |
|------------|---------|---------|---------|-----------|
| વ્યાજ સંચય | 125,000 | 140,000 | 150,000 | 160,000 |
| વ્યાજ સંચય | 30,000 | 35,000 | 40,000 | 45,000 |
| વ્યાજ સંચય | 20,000 | 25,000 | 30,000 | 35,000 |
| વ્યાજ સંચય | 1,000 | 1,000 | 1,000 | 1,000 |
| વ્યાજ સંચય | 5,000 | 5,000 | 5,000 | 5,000 |
| વ્યાજ સંચય | 8,000 | 8,000 | 8,000 | 8,000 |

કુલ સંચય: 189,000

પા.ક.૫

| વ્યાજ સંચય | 2019 | 2020 | 2021 | 15-3-2022 |
|------------|---------|---------|---------|-----------|
| વ્યાજ સંચય | 125,000 | 140,000 | 150,000 | 160,000 |
| વ્યાજ સંચય | 30,000 | 35,000 | 40,000 | 45,000 |
| વ્યાજ સંચય | 20,000 | 25,000 | 30,000 | 35,000 |
| વ્યાજ સંચય | 1,000 | 1,000 | 1,000 | 1,000 |
| વ્યાજ સંચય | 5,000 | 5,000 | 5,000 | 5,000 |
| વ્યાજ સંચય | 8,000 | 8,000 | 8,000 | 8,000 |

કુલ સંચય: 189,000

31/12/21

| | |
|--------------------------------------|-----------|
| 5. Total amount in hand (800) in Rs. | 3,105,000 |
| 6. Bank | |
| 1-1-21 To 1-5-21 = 3,21,00,000 | |
| 1-1-21 To 1-5-21 = 3,21,62,000 | |
| 1-1-21 To 31-4-20 = 3,31,50,000 | |
| 1-5-20 To 31-12-20 = 3,11,22,500 | |
| 1-4-20 To 31-12-20 = 3,57,500 | |
| 1-5-21 To 31-4-21 = 3,57,500 | |

2020 में कंपनी को अर्धवार्षिक रूप से प्रत्येक तिमाही में 25% का बोनस प्रदान किया गया था।
 2021 में कंपनी को अर्धवार्षिक रूप से प्रत्येक तिमाही में 25% का बोनस प्रदान किया गया था।
 बोनस का अंश 25% है।

Q1

- दिए गए खाते में 1-4-21 में दिए गए खाते में अर्धवार्षिक रूप से प्रत्येक तिमाही में 25% का बोनस प्रदान किया गया था।
1. 1-1-21 से 31-3-2021 तक
 2. 1-1-21 से 31-3-2021 तक
 3. 1-1-21 से 31-3-2021 तक
 4. 1-1-21 से 31-3-2021 तक
 5. 1-1-21 से 31-3-2021 तक
 6. 1-1-21 से 31-3-2021 तक
 7. 1-1-21 से 31-3-2021 तक
 8. 1-1-21 से 31-3-2021 तक
 9. 1-1-21 से 31-3-2021 तक

ENGLISH VERSION

The following is the Balance-sheet of Karanda Ltd. as on 31-3-2021.

| Liabilities | Rs. | Assets | Rs. |
|----------------------------------|----------|----------------------|----------|
| Eq. share capital of Rs. 10 each | 2,50,000 | Goodwill | 84,000 |
| Eq. share capital of Rs. 5 each | 1,00,000 | Fixed Assets | 84,000 |
| Reserve and surplus | 60,000 | Cash bal. | 11,000 |
| Current Liabilities | 75,000 | Stock | 1,20,000 |
| Liabilities for expenses | 5,000 | Debtors | 1,45,000 |
| | | Prepaid Expenses | 2,000 |
| | | Preliminary Expenses | 10,000 |
| | 4,40,000 | | 4,40,000 |

Additional information :

1. The fixed assets have been valued 25% higher than its book value.
 2. The expected rate of return is 10%.
 3. Debtors are considered good except Rs. 3,000. Liabilities for expenses are no longer required and a claim for Bonus of Rs. 10,000 is likely to be paid.
 4. Profit for the last four years after taxation were Rs. 40,000; Rs. 50,000; Rs. 60,000 and Rs. 78,000.
 5. Goodwill is to be calculated by average of book value and a valuation made at 3 years purchase of super profits.
- From the above information, find-out the intrinsic value and market value of both types of equity shares.

OR

Following is the balance-sheet of Krishna Ltd. as on dt. 31-3-2021.

| Liabilities | Rs. | Assets | Rs. |
|--|----------|-------------------|----------|
| Share capital : | | Goodwill | 25,000 |
| 4,000 fully paid Equity shares each of Rs. 100 | 4,00,000 | Patents | 4,500 |
| 10% fully paid pref. shares each of Rs. 100 | 1,50,000 | Land and building | 3,00,000 |
| | | -Depreciation | 30,000 |
| | | | 2,70,000 |

| Particular | Rs. | Particular | Rs. |
|---|----------|--------------------|----------|
| Internal Reserve | 75,000 | Other fixed assets | 1,80,000 |
| P & L A/c | 20,000 | -Depreciation | 55,000 |
| Workers's compensation fund | 10,000 | Machinery | 90,000 |
| | | - Depreciation | 12,500 |
| 13% Debentures | 1,25,000 | Investments | 37,500 |
| • Share of subsidiary co. | | | |
| • 10% Debentures in Premul Ltd. at face value | 15,000 | | |
| Creditors | 30,000 | Debtors | 45,000 |
| Bills Payable | 20,000 | Bad Debt Reserve | 55,000 |
| Provident fund | 5,000 | Stock | 2,500 |
| | | Prepaid rent | 52,500 |
| | | Cash and bank | 40,000 |
| | 8,35,000 | | 1,000 |
| | | | 8,35,000 |

Additional Information:

1. Value of land-building after depreciation is depreciated by Rs. 74,500.
 2. Present market value of other fixed assets is Rs. 3,59,000.
 3. Generally, return on capital is 20% for the company which is engaged in the similar type of business. Market value of the share of the company is two-times.
 4. Company's average profit before tax (tax rate 50%) is Rs. 1,80,000.
 5. Goodwill is valued at two years purchase of super profit.
 6. Patents are worthless now.
- Find out Fair value of the share from the above information.

Mr. Rajyashai became insolvent as on 31-3-2022, at that time his position was as under:

| Particular | Rs. |
|--|----------|
| Steady creditors of business | 1,25,000 |
| Preferential creditors | 1,500 |
| Bills - payable | 13,000 |
| Debtors (Realisable value Rs. 25,000) | 40,000 |
| Machinery (Realisable value Rs. 50,000) | 1,00,000 |
| Building (Realisable value Rs. 75,000) | 90,000 |
| Loan against hypothecation of building | 50,000 |
| Vehicles (Realisable value Rs. 20,000) | 30,000 |
| Loan against hypothecation of vehicle | 25,000 |
| Furniture (Realisable value Rs. 8,000) | 12,000 |
| Cash and bank | 1,000 |
| Stock (Realisable value Rs. 12,000) | 20,000 |
| Bills receivable (Fully amount will realise) | 8,000 |

Mr. Rajyashai has commenced his business on 1-4-2018 with capital of Rs. 1,25,500. During the first two years he has made profit of Rs. 8,000 and Rs. 10,000 respectively and in next two years he has made total loss of Rs. 27,000. His average drawings Rs. 8,000 per annum.

Prepare Deficiency Account and Statement of Affairs according to Provincial Insolvency Act, 1920.

OR

Shree Bhimbal has filed petition for insolvency on 30th June, 2022. From the following information prepare Statement of Affairs and Deficiency account :

| Particular | Rs. |
|---|--------|
| Creditors for raw material | 75,000 |
| Bills payable | 5,000 |
| Creditors having lien on shares | 40,000 |
| Liabilities of discounted bills (out of Rs.3,000 are expected to be honoured) | 7,000 |
| Secured loan on stock | 15,000 |
| Creditors having lien on factory | 10,000 |
| Debtors: Solvent (good) | 25,000 |
| Doubtful debtors (estimated to realise Rs. 2,000) | 10,000 |
| Shares (Estimated to realise Rs. 16,000) | 15,000 |
| Stock (Estimated to realise Rs. 40,000) | 60,000 |
| Bank balance | 100 |
| Factory (Estimated to realise Rs. 1,000) | 20,000 |

| | |
|---|--------|
| Bills receivable | 1,400 |
| Machinery (Estimated to realise Rs. 12,000) | 15,000 |
| Fixtures (Estimated to realise Rs. 1,500) | 3,000 |
| Cottages (Estimated to realise Rs. 3,000) | 6,800 |
| Preferential creditors of rent and taxes | 3,000 |

Before six years as on 1-7 his capital was Rs. 50,000. During these six years he earned profit of Rs. 45,000 and loss of Rs. 25,000. Total interest on capital charged Rs. 15,000 and he has withdrawn Rs. 77,200.

- Q.3 Fire broke out in the factory of Ms. Nilam. On 15-3-2022. All goods except of Rs. 3,600 were destroyed. From the following information calculate amount of claim:

| Particulars | 2019 Rs. | 2020 Rs. | 2021 Rs. | Up to 15-3-2022 Rs. |
|---------------|-------------|-------------|-------------|---------------------|
| Purchase | 1,08,400 | 1,12,000 | 1,29,000 | 56,000 |
| Sales | 1,60,000 | 1,50,000 | 1,80,000 | 60,000 |
| Wages | 24,000 | 10,000 | 13,000 | 6,000 |
| Depreciation | 8,000 | 8,000 | 7,000 | 2,000 |
| Opening Stock | 55,000 | 44,000 | 33,000 | 11,000 |

Opening Stock is valued 10% more.

OR

- Q.3 Fire broke out in the factory of Ms. Sima On 31-8-2021. All goods destroyed. They have a policy of fire claim of Rs. 80,000. From the following information calculate amount of claim.

| Particulars | 2018 Rs. | 2019 Rs. | 2020 Rs. | 2021 Rs. |
|-----------------|-------------|-------------|-------------|-------------|
| Opening Stock | 25,000 | 40,000 | 65,000 | 80,000 |
| Sales | 5,00,000 | 6,50,000 | 7,20,000 | — |
| Purchase | 3,50,000 | 3,90,000 | 6,10,000 | — |
| Purchase Return | 10,000 | 12,000 | 9,000 | — |
| Sales Return | 7,000 | 3,000 | 5,000 | — |

In the year-2021, comparing to year-2020, sales and purchase increased by 25% and 20% respectively. There was no sales return or purchase return in 2021. The gross profit will be decided by average of last three years gross profit.

- Q.4 Prepare statement showing loss of profit of Ms. Tulsi from the following information. accounting year ends on 31st December :

| | |
|----------------------------|--------------|
| 1. Indemnity period | 4 months |
| 2. Amt. of Insurance | Rs. 72,520 |
| 3. Date of fire | 1-5-21 |
| 4. Net profit of last year | Rs. 49,000 |
| 5. Fix exp. of last year | Rs. 1,35,000 |
| 6. Sales | Rs. |
| ❖ 1-1-21 To 1-5-21 | 2,10,000 |
| ❖ 1-1-20 To 1-5-20 | 2,62,000 |
| ❖ 1-5-20 To 31-8-20 | 3,15,000 |
| ❖ 1-9-20 To 31-12-20 | 1,22,500 |
| ❖ 1-5-21 To 31-8-21 | 52,500 |

Compared to 2020, in year 2021, Sales and profit will decrease by 20% and 2% respectively. Expense of fire prevention Rs. 945.

OR

- Q.4 Fire took place in the factory of Dilsukh stores. On 1-4-21. Calculate the claim amount from the following details :

- | | |
|---|---------------------------|
| (1) Indemnity period : | 3 Months |
| (2) Amount of Policy : | Rs. 1,04,850 |
| (3) End of financial year : | 31 st December |
| (4) Sales from 1-4-21 To 30-6-21 : | Rs. 1,07,250 |
| (5) Net profit for the year 2020 : | Rs. 50,000 |
| (6) Sale from 1-7-2020 To 31-3-2021 : | Rs. 3,00,000 |
| (7) Sales from 1-4-2020 To 31-3-2021 : | Rs. 5,24,250 |
| (8) Fixed expense for the year ended 31-12-2020 : | Rs. 67,000 |
| (9) Sale for the year ended on 31-12-2020 : | Rs. 11,70,000 |

B.Com. Semester - 4 (CBCS) Examination
March/April-2023 [NEW COURSE]
Computer Science-4(Elective)

Marks: 50

Time: 2:00 Hours

Instructions:
 1. All questions are compulsory.
 2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ નીચેના જવાબ લખો. (૧૪)
- (૧) VB ના ડેટા ટાઇપ સમજાવો.
 (૨) VB માં વેરીએબલનું કાર્યક્ષેત્ર સમજાવો.
 અથવા
- પ્રશ્ન.૨ (૧) IMPLICIT અને EXPLICIT સમજાવો.
 (૨) VB માં ARITHMETIC OPERATOR સમજાવો. (૧૨)
- પ્રશ્ન.૨ નીચેના જવાબ લખો.
 (૧) Lcase(), Trim(), Time(), Len(), Instr(), Rtrim() સમજાવો
 (૨) FOR.....NEXT સમજાવો.
 અથવા
- પ્રશ્ન.૨ (૧) DO WHILE.....LOOP સમજાવો.
 (૨) Ucase(), Now(), Left(), Ltrim(), Right(), Year() સમજાવો. (૧૨)
- પ્રશ્ન.૩ નીચેના જવાબ લખો.
 (૧) Procedure એટલે શું? Procedureની ઉપયોગીતા અને પ્રકારો સમજાવો.
 (૨) Control Array સમજાવો.
 અથવા
- પ્રશ્ન.૩ (૧) Array નું Declaration સમજાવો.
 (૨) User Defined Functions સમજાવો. (૧૨)
- પ્રશ્ન.૪ નીચેના જવાબ લખો.
 (૧) VB માં ફાઈલ ઓર્ગેનાઇઝેશન સમજાવો.
 (૨) Open Statement સમજાવો.
 અથવા
- પ્રશ્ન.૪ (૧) Menu ની ઉપયોગીતા અને પ્રકાર વિષે સમજૂતી આપો.
 (૨) Menu ની વિવિધ પ્રોપર્ટી સમજાવો.

ENGLISH VERSION

- Que.1 Answer the following questions. (14)
- (1) Explain the data type of VB
 - (2) Explain the scope of a variable in VB

OR

- Que.1 (1) Explain IMPLICIT and EXPLICIT
- (2) Explain ARITHMETIC OPERATORS in VB

- Que.2 Answer the following questions. (12)
- (1) Explain Lcase(), Trim(), Time(), Len(), Instr(), Rtrim()
 - (2) Explain FOR..... NEXT

OR

- Que.2 (1) Explain DO WHILE..... LOOP.
- (2) Explain Ucase(), Now(), Left(), Ltrim(), Right(), Year().

- Que.3 Answer the following questions. (12)
- (1) What is procedure? Explain the utility and types of procedures.
 - (2) Explain Control Array

OR

- Que.3 (1) Explain Declaration of Array
- (2) Explain User Defined Functions

- Que.4 Answer the following questions. (12)
- (1) Explain file organization in VB.
 - (2) Explain Open Statement.

OR

- Que.4 (1) Explain the utility and type of Menu.
- (2) Explain various properties of menu

647510

BCM4Bf4E701C

Seat No : _____

B.Com. Semester - 4 (CBCS) Examination
March/April-2023 [NEW COURSE]
Banking & Finance - 4(Elective)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ ક્લિયરિંગ હાઉસ એટલે શું? ક્લિયરિંગ હાઉસની પ્રક્રિયાની સમજૂતી આપો. (૨૦)
અથવા
- પ્રશ્ન.૧ ક્લિયરિંગ હાઉસ એટલે શું? ક્લિયરિંગ હાઉસનું મહત્વ સમજાવો.
- પ્રશ્ન.૨ નાણાકીય નીતિ એટલે શું? નાણાકીય નીતિના હેતુઓની સમજૂતી આપો. (૨૦)
અથવા
- પ્રશ્ન.૨ નાણાકીય નીતિ એટલે શું? નાણાકીય નીતિના સાધનોની ચર્ચા કરો.
- પ્રશ્ન.૩ ભારતમાં બેંકોનાં ખાનગીકરણ માટેની રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા સમજાવો. (૧૫)
અથવા
- પ્રશ્ન.૩ ભારતમાં બેંકોનાં ખાનગીકરણની તરફેણની દલીલોની ચર્ચા કરો.
- પ્રશ્ન.૪ ભારતીય નાણા બજારનો અર્થ આપી ભારતીય નાણા બજારનાં કાર્યોની સમજૂતી આપો. (૧૫)
અથવા
- પ્રશ્ન.૪ ભારતીય નાણા બજારના સાધનોની ચર્ચા કરો.

ENGLISH VERSION

- Que.1 What is a clearing house? Explain the process of clearing house. (20)
OR
- Que.1 What is a clearing house? Explain the importance of clearing house.
- Que.2 What is monetary policy? Explain the objectives of monetary policy. (20)
OR
- Que.2 What is monetary policy? Discuss the instruments of monetary policy.
- Que.3 Explain the Reserve Bank of India guidelines for privatization of banks in India. (15)
OR
- Que.3 Discuss the Arguments in favor of privatization of banks in India.
- Que.4 Define Indian money market and explain the functions of Indian money market. (15)
OR
- Que.4 Discuss the instruments of Indian money market.
